

Seat No. : _____

MA-I-19
April-2007
Economics
(Micro-Economic Analysis)
Paper – I

Time : 3 Hours]

[Max. Marks : 100

- સૂચના :** (1) કોઈપણ ચાર પ્રશ્નના જવાબ લખો.
(2) બધા પ્રશ્નો સરખા ગુણ ધરાવે છે.

૧. સેમ્યુલસનનો અભિવ્યક્તિની પસંદગીનો સિદ્ધાંત સમજાવો. તે હિક્સના નિરાગ્રહ કમપ્રેરિત માંગના અભિગમ કરતાં શું ચઢિયાતો છે ?

અથવા

“કિંમત અસર એ આવક અસર તથા અવેજી અસરનો સરવાળો છે” તે સમજાવો. આ સાથે ગ્રીફન કોયડાની પણ ચર્ચા કરો.

અથવા

લેન્ડેસ્ટરનો માંગનો નવો અભિગમ-એટ્રીબ્યુટ થીયરી ઓફ ડીમાન્ડની ચર્ચા કરો.

૨. ઉત્પાદન વિધેય એટલે શું ? બિનપ્રમાણસર તથા કદના વળતરનાં ઉત્પાદનના નિયમો જણાવો.

અથવા

દ્વિહસ્તક ઈજારો એટલે શું ? તેના કુનોટ, બટ્રાન્ડ અને એજવર્થના મોડલ્સ સમજાવો.

અથવા

મારિસની પેઢીનું વ્યવસ્થાપકનું મોડલ સમજાવો.

૩. રીકાર્ડોના ભાડાનો તથા પ્રો. માર્શલના આભાસી ભાડાના સિદ્ધાંતની ચર્ચા કરો.

અથવા

વહેંચણીના સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો.

૪. ટૂંકનોંધ લખો : (ગમે તે બે)

- (અ) જોખમ અને અનિશ્ચિતતા અંગેનો ન્યુમેન-મોર્ગેન્સ્ટનનો અભિગમ.
- (બ) પેરેટોની ઈષ્ટતમ શરતો
- (ક) સીટોવસ્કીની ટીકા સાથેનો હીક્સ-કાલ્ડોરનો વળતરનો સિદ્ધાંત
- (ડ) બર્ગસન-સેમ્યુલસનનો સામાજિક કલ્યાણ વિધેય
- (ઈ) ઈજારાનું કલ્યાણલક્ષી પાસુ
- (ફ) ભ્રમનું શોષણ.

Seat No. : _____

MA-I-19
April-2007
Economics
(Micro-Economic Analysis)
Paper – I

Time : 3 Hours]

[Max. Marks : 100

Instructions : (1) Attempt any **four** questions.
(2) **All** questions carry equal marks.

1. Explain Samuelson's Revealed Preference Theory. Is it superior to Hicks Logical Ordering Theory of Demand ?

OR

Explain "Price effect is the sum total of the income effect and substitution effect. Also discuss Giffen Paradox.

OR

Discuss Lancaster's New Approach to Demand Theory : Attribute Theory of Demand.

2. What is production function ? State the laws of variable proportion and returns to scale.

OR

What is meant by Duopoly ? Explain the models of Cournot, Bertrand and Edgeworth.

OR

State Marris' model of Managerial Enterprise.

3. Discuss Ricardian Theory of Rent and Quasi Rent by Prof. Marshall.

OR

Explain the Marginal Productivity Theory.

4. Short notes (any **two**) :

- (i) Neumann - Morgenstern approach under risk and uncertainty.
- (ii) Parato optima conditions
- (iii) Hicks- Kaldor compensation principle with Scitovsky paradox.
- (iv) Bergson - Samuelson's Social welfare function
- (v) Welfare aspects of Monopoly
- (vi) Exploitation of labour.